

ન્યૂ જર્સી હાઇવે ઓથોરિટીભાષા એક્સેસ યોજના

P.L. 2023, c.263 મુજબ

યોજનાની અમલ તારીખ: ડિસેમ્બર 15, 2025

ભાષા એક્સેસ સંકલનકર્તા (Language Access Coordinator, "LAC")

ભાષા એક્સેસ સંબંધિત પ્રયત્નો અને સેવાઓ અંગે જાહેર જનતા માટે એજન્સી સાથે સંપર્ક કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે LAC નો સંપર્ક કરવો:

- નામ: સેર્ગીયો ડી. સિમોસ, કાયદાના વકીલ, કાનૂની બાબતોના નાયબ નિયામક
- ફોન નંબર: (732) 750-5300
- ઇમેઇલ સરનામું: NJTALanguageAccess@njta.com
- વેબસાઇટ: www.njta.gov

પરિચય

આ ભાષા એક્સેસ યોજના ("યોજના") ન્યૂ જર્સીના ભાષા એક્સેસ કાયદા, [P.L. 2023, c.263](#) ("કાયદો") નું પાલન કરે છે, જે ન્યૂ જર્સીની આપણા રાજ્યના વિવિધ રહેવાસીઓ માટે આપણા સરકારી સંસાધનોને વધુ સુલભ બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે છે. કાયદા મુજબ રાજ્ય એજન્સીઓએ ભાષા સહાય સેવાઓ પૂરી પાડવાની અને મર્યાદિત અંગ્રેજી કુશળતા ધરાવતા વ્યક્તિઓ સાથે તેઓ કેવી રીતે વાતચીત કરશે અને મદદ કરવા માટે તેઓ કઈ સેવાઓ પ્રદાન કરશે તે સમજાવતી ભાષા એક્સેસ યોજના પ્રકાશિત કરવાની જરૂર છે. ભાષા એક્સેસ યોજના¹ એ એક દસ્તાવેજ છે જે રાજ્ય સરકારની સંસ્થા² અને તેના કર્મચારીઓને પૂરી પાડવાની જરૂરી સેવાઓનું વર્ણન કરે છે જેથી મર્યાદિત અંગ્રેજી કુશળતા ધરાવતા વ્યક્તિઓને તેના કાર્યક્રમો, સેવાઓ અને પ્રવૃત્તિઓ સુધી અર્થપૂર્ણ એક્સેસ મળે.

મર્યાદિત અંગ્રેજી પ્રાવીણ્ય હોવાનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાની પ્રાથમિક ભાષા તરીકે અંગ્રેજી બોલી શકતી નથી અને તેની પાસે અંગ્રેજી વાંચવાની, લખવાની, બોલવાની અને/અથવા સમજવાની મર્યાદિત ક્ષમતા હોઈ શકે છે.

¹ P.L. 2023, c.263 મુજબ, "કાર્યકારી શાખાની દરેક રાજ્ય સરકારની સંસ્થા, જે જનતાને સીધી સેવાઓ પ્રદાન કરે છે, તે માનવ સેવા વિભાગ, કાનૂન અને જાહેર સુરક્ષા વિભાગ, તથા માહિતી તકનીકી કચેરી સાથેની ચર્ચા-સલાહથી એવી ભાષા એક્સેસ યોજના તૈયાર કરશે અને પ્રકાશિત કરશે, જે આ અધિનિયમની જોગવાઈઓનું સંસ્થાએ કેવી રીતે પાલન કરવાનું છે તે દર્શાવશે."

² P.L. 2023, c.263 અનુસાર, "રાજ્ય સરકાર સંસ્થા" ને "કાર્યકારી શાખામાં કોઈપણ રાજ્ય વિભાગ અથવા એજન્સી અથવા જાહેર જનતાને સીધી સેવાઓ પૂરી પાડતું કોઈપણ કમિશન, બોર્ડ, બ્યુરો, વિભાગ, કાર્યાલય અથવા તેના સાધન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે."

આ દસ્તાવેજ નીચેની બાબતો વિશે માહિતી પૂરી પાડે છે:

- અમારી એજન્સી અને અમે જનતા સાથે કેવી રીતે વાતચીત કરીએ છીએ
- મર્યાદિત અંગ્રેજી કુશળતા (Limited English Proficiency, “LEP”) ધરાવતા લોકો જેમને અમે સેવા આપીએ છીએ અથવા જે સેવા આપવાની શક્યતા છે

તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે અમારી એજન્સી:

- ભાષાની જરૂરિયાતો ઓળખે છે
- ભાષા સહાય સેવાઓ પૂરી પાડે છે
- ખાતરી કરે છે કે ભાષા સહાય સેવાઓ ઉચ્ચ ગુણવત્તાવાળી છે
- ઉપલબ્ધ મફત ભાષા સહાય સેવાઓ વિશે જનતાને માહિતી આપે છે
- ન્યુ જર્સીના ભાષા એક્સેસ કાયદાનું પાલન કરવાના અમારા પ્રયાસો વિશે જનતાને માહિતગાર રાખે છે
- LEP ધરાવતા લોકોની સેવા કરવા માટે સ્ટાફને તાલીમ આપે છે
- ન્યુ જર્સીના ભાષા એક્સેસ કાયદાનું પાલન કરે છે.

વિષયનું કોષ્ટક

ન્યૂ જર્સી હાઇવે ઓથોરિટી ભાષા એક્સેસ યોજના.....	1
ભાષા એક્સેસ સંકલનકર્તા	1
પરિચય	1
વિષયનું કોષ્ટક.....	3
A. અમારી એજન્સી અને અમે જનતા સાથે કેવી રીતે સંપર્ક કરીએ છીએ	4
B. અમારી એજન્સી જે લોકોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન મર્યાદિત છે અથવા જે લોકો સેવા આપે તેવી શક્યતા છે.....	5
C. ભાષા સહાય સેવાઓ અને ભાષા ઓળખની જરૂરિયાત નક્કી કરવી	7
D. ભાષા સહાય સેવાઓની જોગવાઈ	8
E. ગુણવત્તા ખાતરી માટેની પદ્ધતિઓ.....	10
F. મફત ભાષા સહાય સેવાઓની ઉપલબ્ધતા વિશે જાહેર સૂચના.....	11
G. હિતધારકો સાથે સંલગ્નતા અને જાગૃતિ પ્રવર્તનો.....	11
H. કર્મચારીની તાલીમ.....	12
I. રેકૉર્ડ જાળવણી, અનુરૂપતા દેખરેખ અને અહેવાલી પ્રક્રિયાઓ.....	13
પરિશિષ્ટ 1: અનુવાદિત મહત્વપૂર્ણ દસ્તાવેજોની યાદી.....	15

A. અમારી એજન્સી અને અમે જનતા સાથે કેવી રીતે સંપર્ક કરીએ છીએ

1. એજન્સીનું ધ્યેય

ન્યૂ જર્સી હાઇવે ઓથોરિટી ("New Jersey Turnpike Authority, NJTA") ની સ્થાપના 1948 માં ન્યુ જર્સી સ્ટેટની કોર્પોરેટ અને નીતિ સંસ્થા તરીકે કરવામાં આવી હતી. તે યુનાઇટેડ સ્ટેટ્સમાં બે સૌથી વ્યસ્ત અને સલામત ટોલ હાઇવેનું સંચાલન અને સંચાલન કરે છે: ન્યુ જર્સી હાઇવે અને ગાર્ડન સ્ટેટ પાર્કવે. NJTA એક સલામત, કાર્યક્ષમ, નવીન અને લવચીક ટોલ રોડ સિસ્ટમ પ્રદાન કરવા માટે કામ કરે છે જે સમગ્ર ન્યુ જર્સી અને તેનાથી આગળ લોકો અને માલસામાનની અવરજવરને સરળ બનાવે છે. NJTA ની હાઇવે સિસ્ટમ ન્યુ જર્સીના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ન્યુ જર્સી ઇન્ટરસ્ટેટ હાઇવે 148 માઇલનો ટોલ રોડ છે, જે I-95 કોરિડોરનો એક ભાગ છે, જે ઇસ્ટ કોસ્ટના મુખ્ય આર્થિક કેન્દ્રોને જોડે છે. નેવાર્ક અને એલિઝાબેથ અને નેવાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટના મુખ્ય બંદરો સાથેના તેના જોડાણો તેને કોમર્શિયલ અને પેસેન્જર વાહનો માટે એક મહત્વપૂર્ણ માર્ગ બનાવે છે. તે ફિલાડેલ્ફિયા અને ન્યુ યોર્ક સિટીની આસપાસના મુખ્ય મેટ્રોપોલિટન વિસ્તારો તેમજ સેટેટના અન્ય રોજગાર કેન્દ્રોમાં આવતા અને જતા ન્યુ જર્સીના રહેવાસીઓને પણ સેવા આપે છે. પાર્કવે એ 172 માઇલનો લિમિટેડ એક્સેસ ટોલ રોડ છે જે સ્ટેટના ઉત્તરથી ન્યુ યોર્ક સ્ટેટ થ્રુવે સાથે જોડાય છે અને દક્ષિણમાં કેપ મે, ન્યુ જર્સી નજીક રૂટ 9 સુધી જાય છે. તે નેવાર્ક-ન્યુ યોર્ક દરિયાકાંઠાના વિસ્તાર અને ન્યુ જર્સી કિનારા વચ્ચેનો પ્રાથમિક હાઇવે છે. આ રસ્તાઓ ઉપરાંત, NJTA મધ્ય ન્યુ જર્સીમાં પાર્કવે સાથે એક મુખ્ય પ્રાદેશિક મનોરંજન કેન્દ્ર, PNC બેંક આર્ટ્સ સેન્ટર (અગાઉ ગાર્ડન સ્ટેટ આર્ટ્સ સેન્ટર તરીકે ઓળખાતું) ની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

2. અમે જનતા સાથે કેવી રીતે વાતચીત કરીએ છીએ

NJTA કર્મચારીઓ વિવિધ માધ્યમો દ્વારા જનતા સાથે વાર્તાલાપ કરે છે, જેમાં ટોલ કલેક્ટર્સ, રોડસાઇડ સહાય ટીમો અને જાળવણી કર્મચારીઓ સાથે સીધો સંપર્ક શામેલ છે. NJTA કર્મચારીઓ સેવા કેન્દ્રો અને આરામ સ્ટોપ પર મર્યાદિત હદ સુધી જનતા સાથે વાર્તાલાપ કરે છે, જે મુખ્યત્વે તૃતીય-પક્ષ કંપનીઓ દ્વારા સંચાલિત થાય છે, અને કેટલાક કિસ્સાઓમાં, સ્થળ પરના સ્ટાફ સાથે. વધુમાં, ન્યુ જર્સી E-ZPass સિસ્ટમ માટે NJTA નું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક સેવા જનતા સાથે સંપર્કના મુખ્ય બિંદુઓ છે. E-ZPass સિસ્ટમ જનતાને ઓનલાઇન, ફોન દ્વારા અથવા ગ્રાહક સેવા કેન્દ્રો પર રૂબરૂમાં ટોલ અને ભાડા ખાતાઓનું સંચાલન કરવાની પરવાનગી આપે છે.

3. ભાગ લેતી સંસ્થાઓ

એક જાહેર એજન્સી તરીકે, NJTA એજન્સી-વ્યાપી ભાષા સુલભતા નીતિઓ અને પ્રક્રિયાઓને અમલમાં મૂકવા અને તેમાં ભાગ લેવા માટે પ્રતિબદ્ધ છે જેથી ખાતરી કરી શકાય કે ન્યુ જર્સીના તમામ રહેવાસીઓને તેમની ભાષા અથવા અંગ્રેજી પ્રોફિશિયેન્સી સ્તરને ધ્યાનમાં લીધા વિના, NJTA માહિતી અને સેવાઓનો ઉપયોગ કરવાની સમાન તકો મળે.

B. અમારી એજન્સી જે લોકોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન મર્યાદિત છે અથવા જે લોકોને સેવા આપે તેવી શક્યતા છે

કાયદા મુજબ રાજ્ય એજન્સીઓ મર્યાદિત અંગ્રેજી કુશળતા ધરાવતી વ્યક્તિઓને ભાષા સહાય સેવાઓ પૂરી પાડે તે જરૂરી છે. આમાં તેઓ જે લોકોને સેવા આપે છે અથવા જે સેવા લેવાની શક્યતા ધરાવે છે તેમની જરૂરિયાતોને ઓળખવાનો સમાવેશ થાય છે, જેમાં લેખિત અને બોલાતી ભાષા બંનેને આવરી લેવામાં આવે છે.

કાયદા હેઠળ, એજન્સીઓએ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને માહિતીનો ન્યુ જર્સીમાં LEP ધરાવતા વ્યક્તિઓ દ્વારા સૌથી વધુ બોલાતી સાત (7) ભાષાઓમાં અનુવાદ કરવો આવશ્યક છે. આ ટોચની સાત ભાષાઓ નક્કી કરવા માટે, અમારી એજન્સી યુ.એસ. વસ્તી ગણતરી ડેટા (અમેરિકન કોમ્યુનિટી સર્વેના ડેટા સહિત) નો ઉપયોગ કરે છે અને ભાષા એક્સેસ અમલીકરણ લીડ એજન્સીઓ સાથે સલાહ લે છે.

આ ડેટા અમારી એજન્સીને હાલમાં અમે જે સમુદાયોમાં સેવા આપીએ છીએ અથવા જે સમુદાયોમાં સેવા આપવાની શક્યતા છે તેમની અન્ય ભાષા લાક્ષણિકતાઓને સમજવામાં પણ મદદ કરે છે, જેનાથી અસરકારક ભાષા એક્સેસ આયોજન સુનિશ્ચિત થાય છે.

આ યોજનાના સમયે, ન્યુ જર્સીમાં LEP ધરાવતા વ્યક્તિઓ દ્વારા બોલાતી ટોચની ભાષાઓ છે:

1. સ્પેનિશ
2. પોર્ટુગીઝ (બ્રાઝિલિયન બોલી માટે પસંદગી)
3. કોરિયન
4. ગુજરાતી
5. ચાઇનીઝ (મેન્ડરિન અને કેન્ટોનીઝ સહિત) ⁴
6. ફ્રેન્ચ કેઓલ અથવા હૈતીયન કેઓલ
7. અરબી

³ P.L. 2023, c.263 અનુસાર, મહત્વપૂર્ણ દસ્તાવેજો એ એવા “દસ્તાવેજો છે, જે કાર્યક્રમની સેવાઓ અથવા લાભોમાં પ્રવેશ, જાળવણી, સમાપ્તિ અથવા બહિષ્કાર અંગે અસર કરે છે અથવા કાનૂની માહિતી આપે છે; કાયદેસર ફરજિયાત છે; અથવા કાનૂની અધિકારો સમજાવે છે.”

⁴ જ્યારે બોલાતી ચાઇનીઝમાં મુખ્યત્વે મેન્ડરિન અને કેન્ટોનીઝનો સમાવેશ થાય છે, ત્યારે લેખિત સંદેશાવ્યવહાર માટે અનુવાદ સરળીકૃત અને પરંપરાગત ચાઇનીઝ અનુસાર હોવો જોઈએ.

1. રાજ્ય સ્તરે ટોચની સાત ભાષાઓ ઉપરાંત ભાષાઓનો ઉમેરો

કાયદામાં એ પણ જરૂરી છે કે રાજ્ય એજન્સીઓ મહત્વપૂર્ણ દસ્તાવેજોનો અનુવાદ તેઓ જે વસ્તીને સેવા આપે છે તેના આધારે એજન્સી દ્વારા જરૂરી ગણાતી અન્ય કોઈપણ ભાષાઓમાં કરે.

અમારી એજન્સીએ ટોચની 7 ભાષાઓ ઉપરાંતની ભાષાઓ ઉમેરવા અંગે નીચે મુજબ નિર્ણય લીધો છે:

NJTA દ્વારા સેવા આપવામાં આવતી વસ્તીની વિવિધ જરૂરિયાતોને આધારે, એજન્સીએ ચોક્કસ પ્રોજેક્ટ-વિશિષ્ટ દસ્તાવેજોનું હિન્દી, પોલિશ અને ટાગાલોગમાં ભાષાંતર કર્યું છે, અને સ્થાન અને અસરગ્રસ્ત સમુદાયોના આધારે, ભવિષ્યના પ્રોજેક્ટ દસ્તાવેજોનું ભાષાંતર કરવાનું પસંદ કરી શકે છે.

2. દુભાષિયા સેવાઓ માટે ઉપલબ્ધ ભાષાઓ

કાયદા હેઠળ, રાજ્ય એજન્સીઓએ સેવાઓ અથવા લાભો આપતી વખતે એજન્સી અને વ્યક્તિ વચ્ચે તે વ્યક્તિની પ્રાથમિક ભાષામાં દુભાષિયા સેવાઓ પૂરી પાડવાની હોય છે.

3. ધરાવતા લોકો

[LEP ધરાવતા લોકોનું વર્ણન કરો જે અમારી એજન્સી સાથે સંપર્ક કરે છે અથવા તેમની સાથે સંપર્ક કરે તેવી શક્યતા છે અથવા અન્યથા જરૂર છે અથવા અમારી એજન્સીની સેવાઓ માટે લાયક છે. આમાં આંતરિક ડેટા અથવા અન્ય સંબંધિત ડેટાસેટ્સ, જેમ કે ભાષા સેવા પ્રદાતાઓ, શાળા જિલ્લાઓ, સમુદાય-આધારિત સંસ્થાઓ, વ્યવસાય સંગઠનો, વગેરે દ્વારા ચોક્કસ ભાષા લાક્ષણિકતાઓ અથવા જરૂરિયાતોને ઓળખવાના કોઈપણ પ્રયાસોનો સમાવેશ થઈ શકે છે. [LEP ધરાવતા લોકોનું વર્ણન કરો જે અમારી એજન્સી સાથે સંપર્ક કરે છે અથવા સંપર્ક કરે તેવી શક્યતા છે અથવા અન્યથા જરૂરતમંદ છે અથવા અમારી એજન્સીની સેવાઓ માટે લાયક છે. આમાં આંતરિક ડેટા અથવા અન્ય સંબંધિત ડેટાસેટ્સ, જેમ કે ભાષા સેવા પ્રદાતાઓ, શાળા જિલ્લાઓ, સમુદાય-આધારિત સંસ્થાઓ, વ્યવસાય સંગઠનો, વગેરે દ્વારા ચોક્કસ ભાષા લાક્ષણિકતાઓ અથવા જરૂરિયાતોને ઓળખવાના કોઈપણ પ્રયાસોનો સમાવેશ થઈ શકે છે.

NJTA તેના રૂટનો ઉપયોગ કરતી બધી વસ્તીને સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે. જે વસ્તી જૂથોને અંગ્રેજી ભાષામાં મુશ્કેલી પડે છે, અને જેઓ ન્યુ જર્સી ટ્રાન્ઝિટ ઓથોરિટી સાથે વાર્તાલાપ કરે છે અથવા તેમની સાથે વાર્તાલાપ કરે તેવી શક્યતા છે, તેમાં ન્યુ જર્સીના રહેવાસીઓ, દૈનિક મુસાફરો, કૉમર્શિયલ ટ્રક ડ્રાઇવરો, ઇમિગ્રન્ટ્સ, શરણાર્થીઓ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, રાજ્યની બહારના મુલાકાતીઓ અને ઓથોરિટીના રાજ્યવ્યાપી સેવા ક્ષેત્રોમાં રહેતા અથવા મુસાફરી કરતા વંશીય જૂથો અથવા સમુદાયોના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે, પરંતુ તે સુધી મર્યાદિત નથી.

C. ભાષા સહાય સેવાઓ અને ભાષા ઓળખની જરૂરિયાત નક્કી કરવી

જ્યારે LEP ધરાવતી વ્યક્તિ અમારી એજન્સીનો સંપર્ક કરે છે, ત્યારે સ્ટાફે નીચેની રીતે ભાષા સહાયની જરૂર છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવું જોઈએ (કોષ્ટકો 1-3).

કોષ્ટક 1: વ્યક્તિગત રીતે

વર્ણન	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
વ્યક્તિ અથવા તેમના સાથી દ્વારા સ્વૈચ્છિક સ્વ-ઓળખ	X
બહુભાષી ભાષા ઓળખ કાર્ડ, પોસ્ટર અથવા દ્રશ્ય સહાયનો ઉપયોગ (ઉદાહરણ તરીકે, “I speak” પોસ્ટર)	
વ્યક્તિની પ્રાથમિક ભાષા ઓળખવા માટે તાલીમ પામેલા સ્ટાફ તરફથી સહાય	
વ્યક્તિની પ્રાથમિક ભાષા ઓળખવા/પુષ્ટિ કરવા માટે લાયક દુભાષિયા (વ્યક્તિગત રીતે, ફોન પર અને/અથવા દૂરસ્થ) તરફથી સહાય	
અન્ય (સ્પષ્ટ કરો):	

કોષ્ટક 2: ટેલિફોનિક સંચાર

વર્ણન	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
વ્યક્તિ અથવા તેમના સાથી દ્વારા સ્વૈચ્છિક સ્વ-ઓળખ	X
વ્યક્તિની પ્રાથમિક ભાષા ઓળખવા માટે તાલીમ પામેલા સ્ટાફ તરફથી સહાય	X
વ્યક્તિની પ્રાથમિક ભાષા ઓળખવા/પુષ્ટિ કરવા માટે લાયક દુભાષિયા (વ્યક્તિગત રીતે, ફોન પર અને/અથવા દૂરસ્થ) તરફથી સહાય	X
અન્ય (સ્પષ્ટ કરો):	

કોષ્ટક ૩: ઇલેક્ટ્રોનિક સંચાર

વર્ણન	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
એજન્સીની વેબસાઇટ પર ઉપલબ્ધ ભાષા સહાય સેવાઓની સૂચના	X
લાગુ પડતા ફોર્મ, પત્રો અને/અથવા ઇમેઇલ સંદેશાવ્યવહારમાં બહુભાષી ટેગલાઇનનો સમાવેશ થાય છે	
વેબસાઇટ પર બહુભાષી ચેટબોટ	
ફક્ત પ્રાથમિક ભાષા ઓળખવા માટે સ્વચાલિત અનુવાદ સાધનોનો ઉપયોગ	X
અન્ય (સ્પષ્ટ કરો):	

D. ભાષા સહાય સેવાઓની જોગવાઈ

1. મહત્વપૂર્ણ દસ્તાવેજ અનુવાદ

કાયદો મહત્વપૂર્ણ દસ્તાવેજોનું અનુવાદન ફરજિયાત કરે છે. P.L. 2023, c.263 અનુસાર, મહત્વપૂર્ણ દસ્તાવેજો એ એવા “દસ્તાવેજો છે, જે કાર્યક્રમની સેવાઓ અથવા લાભોમાં પ્રવેશ, જાળવણી, સમાપ્તિ, અથવા બહિષ્કારને અસર કરે છે અથવા તે વિશે કાનૂની માહિતી આપે છે; કાયદેસર ફરજિયાત છે; અથવા કાનૂની અધિકારો સમજાવે છે.”

અમારી એજન્સી પાસે મહત્વપૂર્ણ દસ્તાવેજોના અનુવાદ માટે નીચેના સંસાધનો ઉપલબ્ધ છે (કોષ્ટક 4).

કોષ્ટક 4: મહત્વપૂર્ણ દસ્તાવેજોના અનુવાદ માટેના સંસાધનો

સ્ત્રોત	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
લાયકાત ધરાવતા, તાલીમ પામેલા અને/અથવા નિયુક્ત બહુભાષી સ્ટાફ	X
કોન્ટ્રાક્ટરો	X
અન્ય (સ્પષ્ટ કરો):	

મહત્વપૂર્ણ દસ્તાવેજોના અનુવાદની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. પરિશિષ્ટ 1 માં આ પ્રકાશનના દિવસ સુધી અનુવાદિત થયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજોની યાદી આપવામાં આવી છે. આ યાદીની જાળવણી અને સુધારો ઓછામાં ઓછું વર્ષમાં એક વખત વાર્ષિક અહેવાલના ભાગરૂપે કરવામાં આવશે.”.

2. ભાષા અનુવાદ સેવાઓ

અમારી એજન્સી પાસે બોલાતી અથવા સાંકેતિક ભાષાના અર્થઘટન (ઇન્ટરપ્રિટિંગ) માટેની વિનંતિઓ માટે નીચે

મુજબના મફત સ્રોતો ઉપલબ્ધ છે (કોષ્ટક 5).

કોષ્ટક 5: બોલાતી અથવા સાંકેતિક ભાષાના અર્થઘટન (ઇન્ટરપ્રિટિંગ) ની વિનંતિઓ માટેના સ્રોતો

સ્રોતો	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
યોગ્ય, પ્રશિક્ષિત અને/અથવા નિયુક્ત બહુભાષી કર્મચારીઓ પાસેથી સહાય	X
ફોન દ્વારા દુભાષિય સેવાઓ	X
સ્થળ પર ઉપસ્થિત દુભાષિય સેવાઓ	
વિડિયો મારફતે દૂરસ્થ દુભાષિય સેવાઓ	
અન્ય (સ્પષ્ટ કરો):	

3. વધારાના સુલભતા સાધનો અને સેવાઓ

કોષ્ટક 6: સુલભતા સાધનો અને સેવાઓ

સાધનસામગ્રી અથવા સેવા	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
એજન્સીના કાર્યક્રમોમાં સહાય માટેના ટેલિફોન અવાજ મેનૂ નીચે જણાવેલ ભાષાઓમાં ઉપલબ્ધ છે (વિગત આપો):	
પ્રશિક્ષિત બહુભાષી સ્ટાફ નીચે દર્શાવેલ પસંદગીની ભાષાઓમાં મર્યાદિત અંગ્રેજી પ્રાવિષ્ટ ધરાવતા વ્યક્તિઓ સાથે સંવાદ કરી શકે છે (વિગત આપો): NJTAની ભાષા સુલભતા નીતિનું NJ E-ZPass પાલન કરે છે અને વિવિધ ગ્રાહક આધારને સેવા આપવા માટે બહુભાષી સ્ટાફ સહાય પૂરી પાડે છે. વધુમાં, NJ E-ZPass વેબસાઇટ સાઇટની સામગ્રીને સ્પેનિશમાં બદલવાનો વિકલ્પ પ્રદાન કરે છે.	X
હિયરિંગ ઇન્કક્શન લૂપ, પોકેટ ટોકર, કેપ્શનિંગ, વિડિયો-દૂરસ્થ દુભાષિય તેમજ/અથવા સમકાલીન દુભાષિય સાધનો જેવા સહાયક સાધનોની સુલભતા ઉપલબ્ધ છે	
સહાયક સહાયની જરૂર હોય તેવા લોકોને સેવા આપતી ભાગીદાર એજન્સીઓ દ્વારા સેવાઓ, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:	
માનવ સેવા વિભાગનો બહેરા અને શ્રવણશક્તિ ગુમાવનારાઓનો વિભાગ	
અન્ય (સ્પષ્ટ કરો): NJTA જાહેર જનતાના તમામ સભ્યો માટે સુલભતાને ટેકો આપવા અને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતા NJTA ને બધી સેવાઓ અને પ્લેટફોર્મ પર વ્યાપક સુલભતા પગલાંનું સતત અન્વેષણ,	X

સાધનસામગ્રી અથવા સેવા	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
અમલીકરણ અને સુધારણા કરવા પ્રેરે છે. NJTA બહેરા અથવા સાંભળવામાં મુશ્કેલી ધરાવતા વ્યક્તિઓ માટે અસરકારક સંદેશાવ્યવહાર અને સુલભતાને સુનિશ્ચિત કરવા અને સુધારવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં જરૂરી સહાયક ઉપકરણો અને સેવાઓનો ઉપયોગ પણ શામેલ છે.	

E. ગુણવત્તા ખાતરી માટેની પદ્ધતિઓ

ભાષા સહાય સેવાઓ સચોટ, ઉચ્ચ-ગુણવત્તાવાળી અને સાંસ્કૃતિક રીતે સક્ષમ છે તેની ખાતરી કરવા માટે, ચાલી રહેલી અથવા આયોજિત પ્રવૃત્તિઓમાં શામેલ છે (કોષ્ટક 7):

કોષ્ટક 7: ગુણવત્તા ખાતરી માટેની પદ્ધતિઓ

પદ્ધતિ	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
સરળ ભાષાના ઉપયોગને પ્રાથમિકતા આપવી	X
ગુણવત્તા ખાતરી ધોરણો લાગુ કરતા ચકાસાયેલ કોન્ટ્રાક્ટરોનો ઉપયોગ કરીને ખાતરી કરવી કે તેના ભાષાશાસ્ત્રીઓ અનુભવી, તાલીમ પામેલા અને યોગ્ય પ્રમાણિત છે અને ભાષાકીય અને સાંસ્કૃતિક રીતે સક્ષમ છે	X
વિકેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી દુભાષિયા અને અનુવાદ સેવાઓની ગુણવત્તાનું નિરીક્ષણ અને ટ્રેકિંગ, અને તે સેવાઓની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે સ્ટાફને તાલીમ આપવી	X
વિકેતા કરારોમાં ગુણવત્તા ખાતરી આવશ્યકતાઓનો સમાવેશ થાય છે, દા.ત., શબ્દકોષો, અનુવાદ સમીક્ષા, અનુવાદ મેમરીનો ઉપયોગ, સ્થાનિકીકરણ સોફ્ટવેર, ડેસ્કટોપ પ્રકાશન, વગેરે	X
સમયાંતરે દુભાષિયા અને અનુવાદ સેવાઓની ગુણવત્તા ચકાસવા માટે સમુદાય-આધારિત સંસ્થાઓ સાથે ભાગીદારી કરવી	X
વિવિધ ભાષાઓમાં અનુવાદિત દસ્તાવેજો અને દુભાષિયા સેવાઓનું સમયાંતરે પરીક્ષણ કરવું	X
સહાયક સહાય અને સાધનો, જેમ કે હિયરિંગ ઇન્ફક્શન લૂપ્સ, પોકેટ ટોકર્સ, કેપ્શનિંગ, ટેબ્લેટ્સ અને/અથવા એક સાથે અનુવાદ સાધનોની ગુણવત્તા અને યોગ્ય જાળવણીની ખાતરી કરવી	X

પદ્ધતિ	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
અન્ય (સ્પષ્ટ કરો): NJTA જનતાના તમામ સભ્યો માટે અસરકારક સમર્થન અને સેવા સુનિશ્ચિત કરવા માટે ભાષા એક્સેસ જરૂરિયાતો અને પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. આ પ્રતિબદ્ધતા NJTAની સ્થાપિત પ્રથાઓ, પ્રોટોકોલ અને પ્રક્રિયાઓ દ્વારા આધારભૂત છે, જેમાં નિયમિત અને નિયમિત ડેટા વિશ્લેષણ, અર્થઘટન સેવાઓની જોગવાઈ, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને સ્વરૂપોની પ્રાથમિકતા અને સાંસ્કૃતિક ક્ષમતા અને અસરકારક કમ્યુનિકેશન વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરતી ચાલુ સ્ટાફ તાલીમનો સમાવેશ થાય છે.	X

F. મફત ભાષા સહાય સેવાઓની ઉપલબ્ધતા વિશે જાહેર સૂચના

અમારી એજન્સી LEP ધરાવતા વ્યક્તિઓને સહાયક સહાય અને સાધનો સહિત જરૂરી ભાષાઓમાં નીચેની રીતે મફત ભાષા સહાય સેવાઓના તેમના અધિકાર વિશે માહિતી આપે છે (કોષ્ટક 8):

કોષ્ટક 8: જાહેર સૂચના

પદ્ધતિ	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
જાહેર જનતા માટે ખૂબ જ દેખાતા વિસ્તારોમાં ચિહ્નો અને પોસ્ટરો	
એજન્સીની વેબસાઇટ પર ઉપલબ્ધ ભાષા સહાય સેવાઓ, પ્રક્રિયાઓ અને કાયદા દ્વારા જરૂરી દસ્તાવેજોનું વર્ણન કરતી માહિતી	X
મુદ્રિત સામગ્રી, પ્રકાશનો અને જાહેરાતો	
અંગ્રેજી સિવાયની ભાષાઓમાં માહિતી પ્રદાન કરતું ટેલિફોનિક વોઇસ મેનૂ	
જાહેર સેવા જાહેરાતો	
અન્ય (સ્પષ્ટ કરો): NJTA ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવા માટે, NJTA સ્ટાફને મર્યાદિત અંગ્રેજી કુશળતા ધરાવતા વ્યક્તિઓ માટે કરારબદ્ધ અર્થઘટન સેવાનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવે છે.	X

G. હિતધારકો સાથે સંલગ્નતા અને જાગૃતિ પ્રવર્તનો

ભાષા એક્સેસ આયોજન અને અમલીકરણ અંગે LEP ધરાવતા લોકોનું પ્રતિનિધિત્વ કરતા સમુદાય અથવા હિસ્સેદાર સંસ્થાઓ સાથે અમારી એજન્સીની સંલગ્નતા શામેલ છે (કોષ્ટક 9):

કોષ્ટક 9: હિતધારકો સાથે સંલગ્નતા અને જાગૃતિ પ્રવૃત્તિઓ

પદ્ધતિ	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
અમારી ભાષા એક્સેસ યોજનાને જાણ કરવા હિતધારકો સાથે સંલગ્નતા ચલાવવી, જેમાં સમૂહો સાથે જાહેર શ્રાવણ સત્રો અને/અથવા વ્યક્તિગત મીટિંગ્સનો સમાવેશ થઈ શકે છે	
આ યોજના અમલમાં મુકાતા અને અપડેટ થાય ત્યારે હિતધારકો સાથે સંલગ્નતા યોજવાનું અને જાળવવાનું આયોજન, જેમાં જાહેર શ્રાવણ સત્રો અને/અથવા વ્યક્તિગત બેઠક સામેલ હોઈ શકે છે	X
વિભિન્ન ભાષા સમુદાયોમાંથી મર્યાદિત અંગ્રેજી પ્રાવિશ્ય ધરાવતા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે કાર્યક્રમ/સેવા-વિશેષ પ્રવૃત્તિઓ અને સંચાર માટે સ્પષ્ટ અને માપવા યોગ્ય લક્ષ્યો હોવા	X
સ્થાનિક, સાંસ્કૃતિક અને ભાષાત્મક રીતે વિવિધ સમુદાય આધારિત સંસ્થાઓ અને મીડિયા સહિતની વિતરણ યાદીઓને જાળવવી અને ઉપયોગ કરવી, જેથી એજન્સીની ભાષા એક્સેસ સેવાઓ સંબંધિત માહિતી પ્રસારિત કરી શકાય	
પ્રતિસાદ મેળવવા માટે વેબસાઇટ અને/અથવા ભાષા એક્સેસ સંબંધિત પ્રશ્નો, પ્રતિસાદ અને/અથવા ચિંતાઓ માટે જાહેર ઇમેલ સરનામું	X

મ. કર્મચારીની તાલીમ

P.L. 2023, c.263 અમલમાં લાવવાના કાર્યમાં સંકળાયેલા સ્ટાફ માટે, વાર્ષિક તાલીમમાં નીચેના વિષયો સામેલ હોય છે (ટેબલ 10):

કોષ્ટક 10: કર્મચારીની તાલીમ

વિષય	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
ભાષા સહાય સેવાઓ પ્રદાન કરવા માટે એજન્સીના કાનૂની જવાબદારીઓ	X
એજન્સીની ભાષા એક્સેસ નીતિઓ અને પ્રોટોકોલ	
ભાષા સહાય સેવાઓ પ્રદાન કરવા માટે એજન્સીના સ્રોતો અને શ્રેષ્ઠ પ્રથાઓ	
દુભાષિય અને અનુવાદક સાથે કેવી રીતે જોડાવું અને કામ કરવું	X
સાંસ્કૃતિક કુશળતા અને સાંસ્કૃતિક સંવેદનશીલતા	

વિષય	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
અનુવાદ અને દોહિત સેવાઓ કેવી રીતે પ્રાપ્ત કરવી	X
LEP ધરાવતા વ્યક્તિઓને પ્રદાન કરાયેલ ભાષા એક્સેસ સેવાઓનો રેકૉર્ડ જાળવવો	

I. રેકૉર્ડ જાળવણી, અનુરૂપતા દેખરેખ અને અહેવાલી પ્રક્રિયાઓ

1. વાર્ષિક આંતરિક નિરીક્ષણ

અમારી એજન્સી આ યોજના અમલમાં કેવી રીતે ચાલી રહી છે તે જોવા માટે, P.L. 2023, c.263 સાથેની અનુરૂપતા સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબ નિરીક્ષણ કરે છે (ટેબલ 11):

કોષ્ટક 11: વાર્ષિક આંતરિક દેખરેખ

પદ્ધતિ	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
આ યોજનાના અમલીકરણ પર એજન્સીના કામની દેખરેખ રાખવા માટે પદ્ધતિઓની સ્થાપનાને સમર્થન આપવું	X
P.L. 2023, c.263 સાથેની અનુરૂપતા અંગે એજન્સીના વાર્ષિક અહેવાલ માટે જરૂરી ડેટા એકત્રિત કરવા અને સંકલિત કરવા	X
P.L. 2023, c.263 મુજબ વાર્ષિક અહેવાલ સમયસર જમા કરવો	X

2. આંતરિક રેકૉર્ડ જાળવણી

અમારી એજન્સી ભાષા એક્સેસ સંબંધિત ડેટાનું સતત ટ્રેકિંગ કરે છે. હાલના ટ્રેકિંગમાં નીચે દર્શાવેલ વસ્તુઓનો સમાવેશ થાય છે [કોષ્ટક 12]:

કોષ્ટક 12: આંતરિક રેકૉર્ડ જાળવણી

માપક સૂચક	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
ભાષા સહાય સેવાઓ માટેની વિનંતીઓની આવૃત્તિ	X
વિનંતીઓ કેવી રીતે પૂર્ણ કરવામાં આવી	X
શું જરૂરી સાત સિવાયની ભાષાઓમાં ભાષા સહાય સેવાઓની વિનંતી કરવામાં આવી હતી	X

માપક સૂચક	લાગુ પડતા બધા (X) પર ચેક કરો
એજન્સી LEP ધરાવતા લોકોને ઉપલબ્ધ ભાષા સહાય સેવાઓ વિશે કેવી રીતે સૂચિત કરવાનો ઇરાદો ધરાવે છે	X
LEP ધરાવતા વ્યક્તિઓને ભાષા સહાય સેવાઓની વાસ્તવિક જોગવાઈનું એજન્સી કેવી રીતે દસ્તાવેજીકરણ કરે છે	
અન્ય (સ્પષ્ટ કરો): ઉપરોક્ત રેકૉર્ડ-કીપિંગ પદ્ધતિઓ ઉપરાંત, NJTA Statewide Traffic Management Center આવતા તમામ ટેલિફોન કોલ્સ માટે રેકૉર્ડ કરેલી ટેલિફોન લાઇન જાળવે છે.	X

પરિશિષ્ટ 1: અનુવાદિત મહત્વપૂર્ણ દસ્તાવેજોની યાદી

મહત્વપૂર્ણ દસ્તાવેજોનું ભાષાંતર એક ચાલુ પ્રક્રિયા છે. આ પ્રકાશનની તારીખ મુજબ, નીચેના મહત્વપૂર્ણ દસ્તાવેજો નીચેની ભાષાઓમાં જાહેરમાં ઉપલબ્ધ છે:

જૂઓ, www.njta.gov (અપડેટ કરવા માટે)